



તા.૧૭-૦૧-૨૦૨૦

પ્રતિ,
તંત્રીશ્રી.

અખબારી યાદી

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ - ૨૦૨૦ ની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઈ રહેલી હોય જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટનાં વ્હાલા શહેરીજનો માટે ત્રણેય ઝોનમાં લોક ડાયરાનું આયોજન - માન. મેયરશ્રી બીનાબેન આચાર્ય, માન. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, માન. મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, માન. સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી આશિષભાઈ વાગડીયા, માન. આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર

સેન્ટ્રલ ઝોનમાં યોજનાર લોક ડાયરામાં રાજ્યનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે, ઈસ્ટ ઝોનમાં યોજનાર લોક ડાયરામાં રાજ્યનાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના માન. મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા, વેસ્ટ ઝોનમાં યોજનાર લોક ડાયરામાં ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડનાં માન. ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરીનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે

કીર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

રાજકોટનાં વ્હાલા શહેરીજનોને લોક ડાયરામાં પધારવા પદાધિકારીશ્રીઓ દ્વારા જાહેર નિમંત્રણ

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ - ૨૦૨૦ ની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઈ રહેલી હોય જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટનાં વ્હાલા શહેરીજનો માટે ત્રણેય ઝોનમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે વધુ માહિતી આપતા માન. મેયરશ્રી બીનાબેન આચાર્ય, માન. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, માન. મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, માન. સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી આશિષભાઈ વાગડીયા, માન. આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે ત્રણેય ઝોનમાં નીચે મુજબની વિગતે અલગ અલગ જગ્યાએ યોજનાર લોક ડાયરામાં કીર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

(૧) તા.૧૮-૦૧-૨૦૨૦ નાં રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે, સ્વામી નારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજ પાછળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજ્યનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવેનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

(૨) તા.૧૯-૦૧-૨૦૨૦ નાં રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે, નાના મવા સર્કલ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડનાં માન. ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરીનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં કીર્તીદાન ગઢવી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

(૩) તા.૨૦-૦૧-૨૦૨૦ નાં રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે, પાણીનાં ઘોડા પાસે, બાલક હનુમાન મંદિર, પેડક રોડ, ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજ્યનાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના માન. મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાનાં વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં ગીતાબેન રબારી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે માન. શ્રીમોહનભાઈ કુંડારિયા - સંસદસભ્યશ્રી, રાજકોટ, માન. શ્રી કમલેશભાઈ મીરાણી - પ્રમુખશ્રી, રાજકોટ શહેર ભા.જ.પ., માન. ધનસુખભાઈ ભંડેરી - ચેરમેનશ્રી ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ, માન. શ્રી નીતિનભાઈ ભારદ્વાજ - પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી, માન. શ્રી ગોવિંદભાઈ પટેલ - ધારાસભ્યશ્રી, રાજકોટ, માન. શ્રી અરવિંદભાઈ રૈયાણી - ધારાસભ્યશ્રી, રાજકોટ, માન. શ્રી લાખાભાઈ સાગઠીયા - ધારાસભ્યશ્રી, રાજકોટ, માન. શ્રીમતી અંજલીબેન રૂપાણી - પ્રભારીશ્રી, રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો ઉપસ્થિત રહેશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે માન. શ્રી ભીખાભાઈ વસોયા - પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, માન. શ્રીમતી ભાનુબેન બાબરીયા - રાષ્ટ્રીય મંત્રી, અનુસુચિત જાતિ મોરચો, માન. શ્રી અશ્વિનભાઈ મોલીયા - ડે. મેયર, રાજકોટ મ્યુ.કો., માન. શ્રી દેવાંગભાઈ માંકડ - મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ., માન. શ્રી કિશોરભાઈ રાહોડ - મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ., માન. શ્રી જીતુભાઈ કોઠારી - મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ. હાજર રહેશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં અતિથી વિશેષ તરીકે માન. શ્રી દલસુખભાઈ જાગાણી - નેતાશ્રી શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો., માન. શ્રી વશરામભાઈ સાગઠીયા - નેતાશ્રી વિપક્ષ, રાજકોટ મ્યુ.કો., માન. શ્રી અજયભાઈ પરમાર - ઇંડક, શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો. હાજર રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં માન. મેયરશ્રી બીનાબેન આચાર્ય, માન. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, માન. મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, માન. સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી આશિષભાઈ વાગડીયા, માન. આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા તથા પદાધિકારીશ્રીઓ દ્વારા રાજકોટનાં વ્હાલા શહેરીજનોને આ લોક ડાયરા કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે.